



JBG-ECT-01-PHILO-A Seat No. _____

M. A. (Sem. I) (CBCS) Examination

December – 2019

Philosophy

(Philosophy of Yoga)

(New Course)

Time : 2½ Hours]

[Total Marks : 70

સૂચના : બધા પ્રશ્નોના ગુણ સરખા છે.

- | | | |
|---|---|----|
| 1 | યોગમાં સમાધિનો ખ્યાલ અને પ્રકારો ચર્ચો. | 14 |
| | અથવા | |
| 1 | યોગનો અષ્ટાંગ માર્ગ સમજાવો. | 14 |
| 2 | યોગમાં વૃત્તિ અને તેના પ્રકારો ચર્ચો. | 14 |
| | અથવા | |
| 2 | યોગમાં પુરુષનો ખ્યાલ સમજાવો. | 14 |
| 3 | યોગમાં કલેશના પ્રકારો સમજાવો. | 14 |
| | અથવા | |
| 3 | યોગમાં કૈવલ્યેના ખ્યાલ ચર્ચો. | 14 |
| 4 | યોગમાં પર અને અપર વૈરાગ્ય સમજાવો. | 14 |
| | અથવા | |
| 4 | યોગમાં વિભૂતિનો ખ્યાલ ચર્ચો. | 14 |
| 5 | ટૂંકનોંધ લખો : (કોઈપણ બે) | 14 |
| | (1) યોગમાં કાર્યકારણનો સિદ્ધાંત | |
| | (2) ક્રિયા યોગનું સ્વરૂપ | |
| | (3) ધર્મમેધ સમાધિ | |
| | (4) ચિત્ત-ભૂમિ (અવસ્થાઓ) સમજાવો. | |

ENGLISH VERSION

Instruction : All questions carry equal marks.

1 Discuss Samadhi and its types of Yoga. 14

OR

1 Explain Yoga's Astang Marg. 14

2 Discuss Vritti and its types in Yoga. 14

OR

2 Explain concept of Purusha in Yoga. 14

3 Explain types of Klesha in Yoga. 14

OR

3 Discuss concept of Kaivalya in Yoga. 14

4 Explain Para and Apara Vairagya in Yoga. 14

OR

4 Discuss concept of Vibhuti in Yoga. 14

5 Write short notes : (any two) 14

(1) Theory of Causation in Yoga

(2) Nature of Kriyayoga

(3) Dharmamedha Samadhi

(4) Explain Chitt-Bhumi (Avastha).